

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૬/૦૯/૨૦૧૬ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૬૩૦/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૯ કેસ કરી, ૩૩ વ્યક્તિઓને ઝડપી ૭૬૮ લીટર દેશી દારૂ અને ૦૬ બોટલ ઇંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૦૧ કેસ કરી ૦૩ વ્યક્તિઓને ઝડપી રૂપિયા ૪,૮૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૬૩૧/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૧૪ વ્યક્તિઓની તેમજ પ્રો.હી.૯૩ મુજબ ૦૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

અપહરણની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૬૩૨/૧૬

ચાંદખેડા : મુકેશભાઈ દીનાનાથ કુબેર (મરાઠી)(રહે.જનતાનગર, ચાંદખેડા) એ તા.૫/૯/૧૬ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩/૯/૧૬ બપોરના ૪/૦૦ વાગ્યા પહેલાં કોઈપણ સમયે સાબરમતી મોટેરા રોડ ઉપર આવેલ સમર્પણ મુક-બધિર શીશુ વિધામંદિર કૃષ્ણવન વિશ્વજ્યોતિ આશ્રમમાંથી મુક-બધિર બાળક સુરજ રામલાલ યાદવ (ઉ.વ.૧૭) ને અજાણી વ્યક્તિ અપહરણ કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એન.એસ.દેસાઈ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૬૩૩/૧૬

ઇસનપુર : અતુલભાઈ સુરેશભાઈ બેડાબે (રહે.ચંદ્રમણી સોસાયટી, ઘનશ્યામનગરની સામે, કેનાલ રોડ, ઘોડાસર) એ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૫/૯/૧૬ બપોરનાં ૨/૩૦ થી ૩/૩૦ વાગ્યા દરમિયાન પોતાનાં મકાનના દરવાજાનો નકુચો તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૮૬,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી સી.ડી.વૈષ્ણવ ચલાવે છે.

ગાડીનો કાય તોડી ચોરી :-

સમાચાર યાદી નં.૧૬૩૪/૧૬

ઘાટલોડીયા : આશીષભાઈ અશોકભાઈ તિવારી (રહે.સ્નેહદીપ સોસાયટી, જલતરંગ બસ સ્ટોપ પાસે, વેજલપુર) એ તા.૫/૯/૧૬ નારોજ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩/૯/૧૬ સાંજનાં ૬/૦૦ થી રાતનાં ૧૦/૦૦ વાગ્યા દરમિયાન ભુયંગદેવ ચાર રસ્તા નજીક સર્વોદય સોસાયટી સામે પાર્કિંગમાં પાર્ક કરેલ પોતાની કારનો જમણી બાજુનો પાછળનો કાય તોડી, અજાણી વ્યક્તિ કારમાંથી મોબાઇલ ફોન, જરૂરી દસ્તાવેજો અને રોકડ રૂપિયા ૮૦,૦૦૦/- ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી મહેશસિંહ દશરથસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.